



RAN-2408000604020007

B.Com. (Sem. IV) Examination October - 2025

Banking (Paper 4) Major Banking Law and Practice

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book
- (2) પ્રશ્ન નં. ૧ ફરજિયાત છે.
- (3) જમણી બાજુના અંક પ્રશ્નોના પુરા ગુણ દર્શાવે છે.

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

- પ્ર-1.** ટૂંકમાં જવાબ આપો. (ગમે તે 5) (10)
- 1) ડિજિટલ બેન્કિંગના સંદર્ભમાં IFCS એટલે શું?
 - 2) તફાવતી વ્યાજ દરની યોજના સમજાવો.
 - 3) સ્ટાર્ટ અપને અગ્રીમ ક્ષેત્ર હેઠળ કેટલી નાણાકીય સહાય કરવામાં આવે છે?
 - 4) એસ. આઈ. ડી. બી. આઈ. નું પૂરું નામ આપો. તેની સ્થાપના કયા વર્ષમાં થઈ?
 - 5) બેંક ખાતામાં નામાંકનની જરૂરિયાત જણાવો.
 - 6) આઈ.એફ.સી.આઈ. નો મુખ્ય હેતુ લખો.
 - 7) શૈક્ષણિક લોન માટે જરૂરી બે દસ્તાવેજોના નામ આપો.
- પ્ર-2.** (અ) અગ્રીમ ક્ષેત્રને ધિરાણ આપવાના હેતુઓ સમજાવો. (7)
(બ) પી.એમ. જન ધન યોજના અંતરંગત ખાતું ખોલાવવા માટે આપવામાં આવતી જરૂરી વિગતો પર નોંધ લખો. (7)
- અથવા**
- પ્ર-2.** (અ) ઇસીજીસીનો ભારતના નિકાસના વિકાસમાં સિંદફાળો છે - ચર્ચા કરો. (7)
(બ) વ્યક્તિગત ખાતું ખોલવાની અરજીનો નમૂનો બનાવો. (7)
- પ્ર-3.** બેંકોમાં જુદા જુદા વ્યવહારો માટેની એસ.ઓ.પી. ની ચર્ચા કરો. (14)
- અથવા**
- પ્ર-3.** એસ.એફ.સી.એસ.ની વિકાસલક્ષી બેન્ક તરીકેની કામગીરીનું મૂલ્યાંકન કરો. (14)
- પ્ર-4.** ટૂંક નોંધ લખો (ગમે તે બે) (12)
- 1) પ્રશ્ન નિવારણ પદ્ધતિ.
 - 2) પર્સનલ લોન અરજીના નિયમો
 - 3) વિકાસલક્ષી બેન્કોના કાર્યો
 - 4) અગ્રિમ ક્ષેત્રના પ્રકારો

ENGLISH VERSION

Q-1. Answer in brief. (Any 5) (10)

1. What is IFSC in reference to digital banking transactions.
2. Explain Differential Rate of Interest scheme.
3. What is the financial lending available to start-ups under priority sector lending?
4. Give full name of SIDBI. When was it established?
5. Why is nomination essential in bank accounts?
6. What is the main objective of IFCI?
7. Name any two documents necessary while applying for educational loan.

Q-2. A. Explain the objectives for lending to priority sectors. (7)

B. Discuss the information that is required while applying for the PM Jan Dhan Yojana. (7)

OR

Q-2. A. Discuss the role of ECGC in development of India's exports. (7)

B. Draft application form for opening individual account. (7)

Q-3. Discuss the SOPs for various banking transactions. **(14)**

OR

Q-3. Evaluate SFC as development bank. **(14)**

Q-4. Write Short-notes (Any 2) (12)

1. Query Resolution Techniques
2. Essential requirements and rules for personal loan.
3. Functions of development banks.
4. Types of priority sector

RAN-2408000604020007 |